

RAN-1805000101050001

F.Y.L.L.B. (Sem. - I) Examination March - 2026 Banking Law

Time: 3 Hours]

[Total Marks: 100

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) Do not change question numbers. (3) Discuss appropriate Case-law & illustrations in support of answers.	Seat No.: Student's Signature
--	--

- પ્ર. 1. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ ચર્ચા કરો. (14)
1. ગુનાઓ અને સજાઓ
2. ન્યાયપંચની રચના અને સત્તાઓ
- અથવા**
- પ્ર. 1. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ બેંકિંગ કંપનીના લાયસન્સ, નવી શાખા ખોલવા અંગે તેમજ હાલની શાખાના ટ્રાન્સફરની મહત્વની જોગવાઈઓની ચર્ચા કરો.
- પ્ર. 2. ભારતમાં બેંકિંગ પ્રણાલીની ઐતિહાસિક પૂર્વભૂમિકા વિગતવાર સમજાવો. (14)
અથવા
- પ્ર. 2. બેંકિંગ લોકપાલ યોજનાના મુખ્ય લક્ષણો જણાવો.
- પ્ર. 3. રિઝર્વ બેંકના કાર્યો તથા તેનો અન્ય બેંકો ઉપરનો અંકુશ સમજાવો. (14)
અથવા
- પ્ર. 3. રિઝર્વ બેંકના મહત્વના ઉદ્દેશો જણાવી રિઝર્વ બેંક કયા કામકાજ ન કરી શકે તે સમજાવો.
- પ્ર. 4. ધીરાણ (શાખ) ની માહિતી એકત્રિત કરવા અને પૂરી પાડવા માટે રિઝર્વ બેંકની સત્તાની ચર્ચા કરો. (14)
અથવા
- પ્ર. 4. ‘દરેક ચેક વિનિમયપત્ર છે પરંતુ દરેક વિનિમયપત્ર ચેક નથી’. આ નિવેદનની ચર્ચા કરો.
- પ્ર. 5. પરક્રમ્ય લેખના પક્ષકારોની જવાબદારીઓ અંગેની જોગવાઈઓ સમજાવો. (14)
અથવા
- પ્ર. 5. વચનચિદ્ધિ શું છે? તેની લાક્ષણિકતાઓ સમજાવો.
- પ્ર. 6. બેંકિંગ લોકપાલ સમક્ષ કેવી રીતે ફરિયાદ કરી શકાય અને ફરિયાદ પૂર્વેની શરતો જણાવો. (14)
અથવા
- પ્ર. 6. બેંકિંગ લોકપાલ યોજના હેઠળ ફરિયાદ નિવારણ માટેની કાર્યવાહી સમજાવો.

પ્ર. 7.	ટૂંકનોંધ લખો (કોઈપણ બે)	16
1.	બેંકિંગ લોકપાલની સત્તાઓ	
2.	લોન અને એડવાન્સ પર નિયંત્રણો	
3.	અનાદરની નોટિસ	
4.	અનામત ભંડોળ	

ENGLISH VERSION

Q. 1.	Discuss under the Banking Regulation Act, 1949.	14
1.	Offences and punishments.	
2.	Constitution of tribunal and its powers.	
	OR	
Q. 1.	Discuss the important provisions of licensing of banking company, opening of new branch and transfer of existing branch under the Banking Regulation Act, 1949.	
Q. 2.	Explain in detail the Historical background of Banking system in India.	14
	OR	
Q. 2.	State the salient features of banking ombudsman scheme.	
Q. 3.	Explain the functions of reserve bank and its control over other banks.	14
	OR	
Q. 3.	State the important objectives of reserve bank. Business which the reserve bank of India may not transact.- Explain	
Q. 4.	Discuss the power of reserve bank for collection and furnishing of credit information.	14
	OR	
Q. 4.	“Every cheque is a bill of exchange but every bill of exchange is not a cheque”- Discuss this statement.	
Q. 5.	Explain the provisions regarding liabilities of parties to the negotiable instrument.	14
	OR	
Q. 5.	What is promissory note? Explain its characteristics.	
Q. 6.	How to complaint before banking ombudsman and state the conditions before complaint.	14
	OR	
Q. 6.	Explain procedure for redressal of grievances under the banking ombudsman scheme.	
Q. 7.	Write short notes. (Any two)	16
1.	Powers banking ombudsman	
2.	Restriction on loans and advances	
3.	Notice of dishonour	
4.	Reserve fund	